

વસ્તીગણતરી 2021 તમારા પ્રશ્નોના જવાબ



વસ્તીગણતરી થઈ રહી છે

તે આપણા સમાજ માટે અગત્યની હોય તેવી બાબતો વિશેના નિર્ણયો લેવામાં માહિતી પૂરી પાડે છે.

આ પત્રિકામાં તમને **વસ્તીગણતરી 2021** વિશે સામાન્ય રીતે પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ મળી રહેશે.

વસ્તીગણતરીની તમારી પ્રશ્નાવલિ ભરવાનું અગત્યનું છે, કારણ કે તેના લીધે આપણા સમાજ વિશેની અમારી પાસેની છેલ્લામાં છેલ્લી વિગતો અમને મળી રહે છે. કાયદા મુજબ તમારે વસ્તીગણતરી ભરવી આવશ્યક છે.

વસ્તીગણતરીના આંકડાથી તમારા વિસ્તારમાં જાહેર સેવાઓ ઉપરના નિર્ણયોના ભંડોળ વિશેની માહિતીમાં અમને મદદ થાય છે. પછી તે નવી સ્કૂલો, ડોક્ટરની સર્જરીઓ કે પછી બાઈક લેનનાં આયોજનો હોય, તમે જે માહિતી આપો છો તેની ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રહેતાં તમામ લોકોનાં જીવન પર અસર પડે છે.

મારી વસ્તીગણતરીની પ્રશ્નાવલિ મારે ક્યારે ભરવી જોઈએ?

વસ્તીગણતરીનો દિવસ રવિવાર 21 માર્ચ છે - પરંતુ તમને પોસ્ટમાં તમારો એક્સેસ કોડ મળે એટલે તરત જ તમે તે ભરી શકો છો.

તમારા જવાબો આ તારીખે સામાન્ય રીતે તમારા ઘરમાં રહેતાં લોકો વિશે હોવા જોઈએ - તમે તે તારીખ પહેલાં ફોર્મ ભરી રહ્યાં હો તો પણ.

જો વસ્તીગણતરીના દિવસે તમારા ઘરના સંજોગો બદલાય, તો તમે અમને જણાવી શકો છો.

જો તમને મદદની જરૂર હોય, તો જુઓ
www.census.gov.uk

  
[@Census2021](https://www.census.gov.uk)

વસ્તીગણતરીએટલે શું?

વસ્તીગણતરી એટલે કરવામાં આવતો એક સર્વે છે જે દર 10 વર્ષે થાય છે અને તેનાથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રહેતાં તમામ લોકો અને કુટુંબો ચિત્ર મળે છે. તમામ પ્રકારની સંસ્થાઓ, લોકલ ઓથોરિટીઓથી માંડીને ચેરિટીઓ પરિવહન, શિક્ષણ તેમજ આરોગ્ય સંભાળ સહિતની આપણને જોઈતી સેવાઓ પૂરી પાડવામાં મદદ માટે આ માહિતીનો ઉપયોગ કરે છે. વસ્તીગણતરી વગર તે કરવાનું ઘણું વધારે મુશ્કેલ બને.

શું મારે આમાં ભાગ લેવો જ પડે?

જો તમે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રહેતાં હો, તો તમારે વસ્તીગણતરી ભરવી ફરજિયાત છે. વસ્તીગણતરીની માહિતીથી જાહેર ભંડોળના કરોડો પાઉન્ડ કેવી રીતે વાપરવામાં આવે તે માહિતી પૂરી પાડવામાં મદદ થાય છે. વસ્તીગણતરીની પ્રશ્નાવલિ ભરવામાં દર વ્યક્તિ દીઠ લગભગ 10 મિનિટનો સમય ફાળવીને, તમે આપણા સમાજોને હાલમાં તેમજ ભવિષ્યમાં જોઈતી સેવાઓ મળી રહે છે તેની ખાતરી કરવામાં મદદ કરશો.





મેં આપેલી માહિતીનો ઉપયોગ સરકાર મને ઓળખવા માટે કરશે?

ના. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) વસ્તીગણતરી કરે છે. અમે વસ્તીગણતરીમાંથી માત્ર બેનામી માહિતી જ પ્રકાશિત કરીએ છીએ. હકીકતમાં, વસ્તીગણતરીની અંગત માહિતીની આપ-લે કરવાનું અપરાધ છે અને તમે અમને જે કંઈ પણ કહેશો તે સુરક્ષિત રાખવામાં આવે છે.

વસ્તીગણતરીથી મને કેવી રીતે ફેર પડશે?

વસ્તીગણતરીથી દરેકજાણને ફેર પડે છે. તે દાયકામાં એકવાર મળતી તક છે જ્યારે તમે તમારો અવાજ સંભળાવી શકો છો અને તમારા સ્થાનિક વિસ્તારના ભવિષ્યને આકાર આપવામાં મદદ કરી શકો છો.



વસ્તીગણતરીમાં આપવામાં વિકલ્પો સાથે મારી ઓળખ ન થતી હોય તો શું કરવું?

વસ્તીગણતરીમાં તમારા વંશમૂળ, લિંગ અને લૈંગિક અભિગમ, ધર્મ તેમજ રાષ્ટ્રીય ઓળખ વિશે પૂછવામાં આવે છે. દરેક પ્રશ્નો જવાબ તમે કેવી રીતે આપવા માગો છો તે તમારી ઉપર છે. તમને તમારા માટે જે સર્વોત્તમ યોગ્ય લાગતું હોય તે રીતે તેનો જવાબ આપો.

મેં આપેલી માહિતીની મારા બેનિફિટો કે ઈમિગ્રેશન સ્થિતિ પર અસર પડી શકે?

ના. તમે વસ્તીગણતરીમાં જે કંઈ પણ માહિતી આપશો તેનો ઉપયોગ બેનિફિટોના કલેઈમ પર, રહેવાસ માટેની અરજી, ઈમિગ્રેશનની સ્થિતિ અથવા તમારા કરવેરા પર પ્રભાવ પાડવા માટે ન કરી શકાય.

ONS સરકારથી સ્વતંત્ર છે. એટલે કે તમને મળતા પેમેન્ટો કે સેવાઓ અંગે કાર્યવાહી કરતા અધિકારીઓ તમારી વસ્તીગણતરીની માહિતી જોઈ શકતાં નથી.



મારી વસ્તીગણતરીની પ્રશ્નાવલિ હું ઓનલાઈન ન ભરી શકું તો?

અમે જાણીએ છીએ કે કેટલાંક લોકોને આ મુશ્કેલ લાગશે. એટલા માટે અનેક પ્રકારની સહાય સેવાઓ સાથે અમે અહીં મદદ કરવા માટે હાજર છીએ. તમારી જે કંઈ પણ જરૂરતો હશે, અમે તમારા માટે તે સહેલું બનાવી આપીશું.

સેવાઓમાં આનો સમાવેશ થાય છે:

- અનેક ભાષાઓ અને સ્વરૂપોમાં માર્ગદર્શન અને સહાયતા
- ફોન પર, વેબ ચેટ અથવા સોશિયલ મીડિયા મારફતે મદદ
- જો તમે ઈચ્છો તો કાગળ પર છાપેલા સ્વરૂપમાં પ્રશ્નાવલિ
- વસ્તીગણતરીની સુવિધાજનક માર્ગદર્શિકા, દાખલા તરીકે બ્રેઈલમાં

જો તમને મદદની જરૂર હોય, તો જુઓ
www.census.gov.uk

  
[@Census2021](https://www.census.gov.uk)

શા માટે વસ્તીગણતરીમાં મારા લિંગ અને મારા લૈંગિક અભિગમ વિશે પૂછવામાં આવે છે?

આ વસ્તીગણતરીમાં પહેલીવાર લૈંગિક અભિગમ તેમજ લૈંગિક ઓળખ વિશેના સ્વૈચ્છિક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આ અમને લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ તેમજ ટ્રાન્સજેન્ડર વસ્તી વિશે વધારે સચોટ માહિતી આપવા માટે છે.



આનાથી જો કોઈ જૂથોને અસમાનતાઓનો સામનો કરવો પડતો હોય તો સંસ્થાઓને તેની સામે પગલાં લેવામાં અને ક્યાં સેવાઓની જરૂર છે તે બતાવવામાં મદદ થશે. આ પ્રશ્નો અમે માત્ર 16 વર્ષ અને તેથી વધારે ઉંમરનાં લોકોને જ પૂછીશું.

જો તમે તમારા ઘરનાં બીજાં સભ્યોની સાથે એક જ ફોર્મ પર આ માહિતી જાહેર કરવામાં અસ્વસ્થતા અનુભવતાં હો, તો તમે વ્યક્તિગત વસ્તીગણતરીની પ્રશ્નાવલિ મંગાવી શકો છો અને અલગથી તેના જવાબ આપી શકો છો.

વસ્તીગણતરીમાં હું મારા મિત્રો અને કુટુંબીજનોને મદદ કરી શકું?

અમે પ્રશ્નાવલિ બને તેટલી સહેલી બનાવી છે.

જો કોઈ મિત્ર અથવા કુટુંબના સભ્યને મદદની જરૂર હોય તો તમારાથી બની શકે તો તે આપો. હંમેશાં તમારી પોતાની વસ્તીગણતરી પહેલાં ભરો.

તમે તમારા પોતાના માટે, અથવા બીજા કોઈ માટે મદદની માગણી હંમેશા કરી શકો છો.

વસ્તીગણતરીનો દિવસ રવિવાર 21 માર્ચ છે

ભાગ લેવાનું સહેલું છે. જો તમને તમારું વસ્તીગણતરીનું ફોર્મ ભરવામાં મદદની જરૂર હોય, તો અમે તે આપી શકીએ છીએ.



અમે તમને એક્સેસ કોડ સાથેનો
એક પત્ર મોકલીશું.



અમારી સિક્યોર વેબસાઈટ પર જાવ
અને શરૂ કરવા માટે તમારો એક્સેસ કોડ
દાખલ કરો.

જો તમને અથવા તમે જાણતાં હો તેવા બીજા કોઈને મદદની જરૂર હોય, તો વ્યાપક પ્રકારની સહાય સેવાઓ મળી શકે છે.

જો તમને મદદની જરૂર હોય, તો જુઓ
www.census.gov.uk

  
@Census2021